

બાળકોનું બાઈબલ

રજૂ કરે છે :



ઇશ્રર

ગુલામ

યુસ્તફને

માન

આપે છે

લેખક : Edward Hughes

સુચરિત્ર કરનાર : M. Maillot; Lazarus

અનુકૂલન : M. Maillot; Sarah S.

માધ્યાત્ર કરનાર : મનોજકુમાર આઈ. પ્રિસ્ટી

નિર્માતા : Bible for Children


www.M1914.org

©2017 Bible for Children, Inc.


પરવાનગી : આ સાહિત્યનો જ્યાં સુધી તમે વ્યાપર કરતા નથી
ત્યાં સુધી તમે તેની નકલ છાપી શકો છો.



પુસ્કને તેના પહેલા માલિક
પોટીફાર દ્વારા ખોટી રીતે
જેલમાં નાંખવામાં આવ્યો
હતો. જેલમાં પણ
પુસ્ક આજાધિન
અને મદદરૂપ
હતો.



જેલના દરોગાએ તેને જેલનું
છવન સુખ્યવસ્થિત કરવા માટે
વિશ્વાસપૂર્વક નિમણાંક કરી
હતી. ઈશ્વર યુસેફની
સંઘાતે હોઈ, દરેક
વ્યક્તિ માટે જેલ
એક સારી જગ્યા
બની ચૂકી હતી.



રાજના ભઠ્ઠિયારાને અને
પાત્રવાહકને જેલમાં નાખવામાં
આવ્યા હતાં. “તમે કેમ ખૂબ જ

નિરાશ
દેખાઓ
છો?”,



એક દિવસે યુસુફ તેમને પૂછતું.

“અમારા સ્વમનાં અર્થ કોઈ


બતાવી શકે તેમ નથી,” હુઃખી

પુરુષોએ
જવાબ
આપ્યો.



“ਇਹਾਰ ਤੇ ਕਰੀ ਸ਼ਾਕੇ ਛੇ!”

ਪ੍ਰਸ਼ੰਸਕ ਜਵਾਬ ਦੀਥੋ। “ਤਮਾਰਾ
ਖ਼ਾਮੀ ਮਨੇ ਬਤਾਵੋ।”



“તારા સ્વપ્નનો અર્થ એ છે કે ગજા દિવસમાં તને
રાજાની હજુરમાં પાછો લઈ જવાશે અને તને ફાડુન

રાજાની મહેર પ્રાપ્ત

થશે.” યુસ્કે

પાત્રવાદકને કહ્યું,

“મને યાદ રાખજો

અને મની

અહીંથી


છોડાવજો”



ભઠ્ઠિયારાના સ્વપ્રનો અર્થેના માટે ખરાબ સમાચાર
હતાં. “તાજા દિવસમાં તું મૃત્યુ પામીશ” યુસુકે જવાબ
વાળ્યો. બંને
સ્વપ્રો સાચા
પડ્યાં.



એક દિવસ ફારુન રાજી ઉંઘમાંથી
એકાએક જાગી ઉઠ્યો, તે દિવસ સુધી
પાત્રવાહક યુસ્ફ
વિશે ભૂલી




ગયો હતો.
“મને એક સ્વમુ આવ્યું
હતું” તેણે હાંક મારી.



પણ રાજાના એક પણ બુદ્ધિમાન
માણસો તેનો અર્થ કરી શક્યા નહિં.



ત્યારે પાત્રવાહકને
યુસ્ફ વિશે યાદ



આવી. તેણે
ફારુન રાજાને તેના
વિશે માહિતી આપી.



ફારુને પૂસફને તરત તેડી મંગાવ્યો.
“તમારું સ્વમું ઈશ્વર તરફનો એક સંદેશ છે.”



યુસફ રાજાને કહ્યું, “મિસરમાં
સાત વર્ષ પુષ્પળ આબાદી આવશે,
ત્યારબાદ સાત વર્ષ મધ્યંકર ફુકાળ પડશે.”



“આ આબાઈના સાત વખ્ઝો
દરમ્યાન અનાજનો સંગ્રહ
કરો.” યુસુફે ફારુનને
સલાહ આપી.

“નહિંતર
દુકાળમાં લોકો
ભૂખે મરી
જશે.” ઈશ્વર
તારી સાથે છે.



ફારુને જવાબ દીધો. “તું
મિસર દેશનો પ્રધાન બનશો,
તું મારી પણીનો
બીજો વ્યક્તિ
હોઈશ.”



આબાઈના સાત વર્ષ આવ્યા. ત્યારબાદ કુકાળના
સાત વર્ષ આવ્યા. મિસર વગર આખી હુનિયામાં
આકરો હુષ્ણાળ હતો, ...



...ફક્ત મિસરમાં પુષ્પળ અનાજ હતું, કારકા કે
તેઓએ બુદ્ધિથી તેનો સંગ્રહ કર્યો હતો. યુસ્ફ પોતાના
વતનથી ખૂબ જ દૂર હતો. જ્યાં ચાકૂબનું કુટુંબ
મૂખે મરતું હતું.



ਦੁਨਿਆਨਾ ਦੇਕ ਦੇਸ਼ਾਨਾ ਲੋਕੋ ਮਿਥਰ ਦੇਸ਼ਮਾਂ ਅਨਾਝ
ਖਰੀਏਵਾ ਮਾਟੇ ਗਏ।

“ਤਮੇ ਪਾਣੇ
ਜਾਓ।”



યાકુબે તેના પુત્રોને આજ્ઞા આપી, “નહિંતર આપણો
ભૂખે મરી જઈશું” મિસરમાં આવીને, આ

દિકરાઓ અનાજ
ખરીદવાની
તૈયારી કરી.



યાકુબના પુત્રો પ્રભુતા ધરાવતા એ વ્યક્તિ આગળ
ન મી પડ્યાં. તેઓએ પોતાના ભાઈ યુસ્ફને
ઓળખ્યો નહિં. પણ યુસ્ફે તેમને ઓળખી
લીધા. યુસ્ફને તેનું નાનપણનું સ્વમ્ય યાદ
આવ્યું. ઈશ્વરે તેને તેના ભાઈઓ કરતાં



યુસફ ખૂબજ બુદ્ધિમાન હતો. તેણે તેમની
સાથે કઠોર વર્તન કર્યું અને
તેમના ભાઈ સીમીયોનને

જમીન પર

રાખ્યો.



“તમે આ અનાજ લઈને તમારા ઘરે જાઓ
અને તમારા નાના ભાઈને લઈને આવો.”

તેણે હુકમ કર્યો. ત્યારબાદ હું

જાળિશ કે તમે

અસૂસ
નથી.



તેના ભાઈઓ વિચારવા લાગ્યા કે તેમણે
તેમના ભાઈને ગુલામ તરીકે વેચી દીધો
હોવાથી ઈશ્વર તેમને શિક્ષા
કરી રહ્યો હતો.



યાકૂબ અને તેના દીકરા ગુંચવણમાં મુકાઈ
ગયા. “અમારા પૈસા તેણો અમને અમારી
ગુણોમાં પાછા આપ્યા છે, અને તેણો
કહું છે કે અમારે બિન્યામીનને તેની

પાસે ખચીત લઈ
જવાનો છે.”



પણ ચાકુબ બિન્યામીનને જવા દેવા માંગતો ન
હતો. હવે અનાજ પૂરું થઈ ગયું હતું. આ
માઈઓને ફરી મિસર જવું પડ્યું.

બિન્યામીન પણ તેમની સાથે ગયો.



જ્યારે યુસુફ બિન્યામીનને જેથો ત્યારે તેણે તેના
ચાકરોને એક મોટી મિજબાની તૈયાર કરવા માટે હુકમ
કર્યો. ત્યાર બાદ બધા ભાઈઓને નિમંત્રણ આપ્યું.



“શું તમારો બાપ જીવે છે અને મજામાં છે?” યુસ્કે
પ્રશ્ન પૂછ્યો. કદાચ તે વિચારતો હશે કે તેઓ કેવી
રીતે પોતાના આખા કુટુંબને ભેગા લાવી શકે.



યુસ્ફ પોતે પણ જાગવા માંગતો
હતો કે તેના ભાઈઓ તેમણે કરેલા
તેમના ભૂતકાળના પાપ
વિશે દિલગીર છે કે કેમ.
જમણ પછી તેને તેમને

ચોરી કરવા માટે
આરોપ મૂક્યો. “તમને
શિક્ષા કરવા માટે હું
બિન્દ્યામીનને મારા ...



... ગુલામ તરીકે રાખીશ, ”યુસ્કે
કહ્યું. “મારા માલિક તમે મારું
જીવન લો” યહૃદાએ
ભીખ માણિ. યુસ્ક
જાણિ ગયો કે યહૃદા

જેણે તેને વેચવા
માટે સલાહ આપી
હતી તે ખરેખર
બદલાઈ ગયો હતો.



હવે તે પોતાનો પ્રેમ પોતાના કુટુંબથી
છુપાવી શક્યો નાણિ. તેણે
બધા મિસરીઓને
બહાર મોકલી

દીધા.

ત્યારબાદ તે

રૂદ્ધ કરવા
લાગ્યો.



“ਤੁਂ ਤਮਾਰੇ ਭਾਈ ਯੁਸਫ ਹੈਂ. ਜੇਨੇ ਤਮੇ
ਮਿਸਰਮਾਂ ਵੇਚੀ ਦੀਧੋ” ਤੇ ਆਂ
ਆਕਾਰ ਪਾਮੀਨੇ
ਗਭਰਾਈ ਗਿਆ.
ਪਾਣੀ ਤੇ ਆਂਦੇ
ਅੰਕ ਪਾਣੀ ਰਾਹੋਂ

ਕਹਿੰਦੇ ਹਨ.



યુસુફે તેના માટેઓને પ્રોત્સાહન



... સમયમાં હું તમારા જવનો

બચાવું. જીઓ
અને મારા પિતાને
મારી પાસે તેડી લાવો.
હું તમારી સંભાળ

રાખીશ."



યાકુબ અને યુસુફ મિસરમાં ફરી



ભેગા મળ્યા. તે
સમય પછી તેનું આખું
કુટુંબ ત્યાં શાંતિ અને
આબાદીમાં જલ્દ્યા.

ઈશ્વર ગુલામ યુસ્ફને માન આપે છે

બાઈબલ, ઈશ્વરના વચનમાંથી વાત્તી

જે આપણાને મળે છે,

ઉત્પત્તિ ૩૮-૪૪

“તમારા વચનનો પ્રવેશ પ્રકાશ આપે છે.”

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૦



સમાન



આ બાઈબલની વાત જણાવે છે. આપણાને
કોણે બનાવ્યા અને તે હિંદુ છે કે તમે તેને ઓળખો.

ઈશર જાણો છે કે આપણો ખરાબ
બાબત કરી કે જેને તે પાપ કહે છે. પાપની શિક્ષા
મરણ છે, પણ ઈશર આપણાને ખૂબ જ પ્રેમ કરે છે. જેથી તેણે
પોતાનો એકનો એક દિકરો, ઈસુ તેને મોકલી આપ્યો છે, જે
વધ્યસ્તંભ પર મરી જઈને તમારા પાપની શિક્ષાને ઉઠાવી લીધી છે.
ત્યાર બાદ પ્રભુઈસુ જીવતા પાછા ઉઠીને પોતાનું ઘર જે સ્વર્ગ છે
તેમાં ગયા છે. તમે ઈસુ પર વિશ્વાસ રાખો છો તમે તમારા પાપોની
માફી માટે તેની પાસે માંગી શકો છો, તે તમારા પાપ માફ કરશો, તે
તમારી પાસે હંદ્યમાં અંદર આવીને તમારી સાથે રહેશો
અને તમે સંદર્ભાળ તેની સાથે રહી શકશો.



જો તમે આ સત્યને સ્વીકારો છો તો તમે આ કહો:
પ્રિય ઈસુ, હું માનું છું કે તમે ઈશ્વર છો, અને મારા પાપો માટે
મૃત્યુ પામવા માણસ બન્યા, તમે આજે જીવીત છો, કૃપા કરી
તમે મારા જીવનમાં આવો અને મારા પાપોની માફી આપો.
જેથી મને નવું જીવન પ્રાપ્ત થાય અને હું સંદા તમારી સાથે રહી
શકું. તમારી આજ્ઞાઓ પાળવા માટે મને મદદ કરો જેથી હું
તમારું બાળક બની શકું. આમીન.

બાઈબલ વાંચો અને ઈશ્વરની સાથે દરરોજ
વાત કરો યોહાન ૩:૧૬

